



જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૦/૧૧/૨૦૧૮ શનિવાર

**અમદાવાદ શહેર પોલીસ સમાચાર**

**નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-**

**સમાચાર યાદી નં.૨૧૯૩/૧૮**

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૧ કેસ કરી, ૩૦ વ્યક્તિઓને ઝડપી, ૫૫ લીટર દેશી દારૂ કબજે કર્યો હતો. તેમજ જુગારધારા હેઠળ ૦૨ કેસ કરી ૧૪ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૩૯,૬૬૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

**તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-**

**સમાચાર યાદી નં.૨૧૯૪/૧૮**

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૨૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી-૯૩ મુજબ ૦૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

**વિશ્વાસઘાત અને છેતરપીંડી :-**

**સમાચાર યાદી નં.૨૧૯૫/૧૮**

શાહીબાગ : સુમીતભાઈ મનુભાઈ પ્રજાપતિ (ઉ.વ.૨૯)(રહે.ગુ.હા.બોર્ડ મેઘાણીનગર) એ તા.૯/૧૧/૧૮ નારોજ શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૬/૧૧/૧૮ ના કલાક ૧૧/૪૫ વાગ્યાના સુમારે સુમીતભાઈ ની પત્નીની ખબર અંતર પુછવા આવેલ સુમીતભાઈના મોટા બાપુજી વિઠ્ઠલભાઈ કામાભાઈ તથા તેમની બા રૂખીબેન વિઠ્ઠલભાઈ નાઓને સિવિલ હોસ્પિટલ ગેટ નંબર-૫ નજીક એક મોટર સાયકલ ઉપર આવેલ પુરૂષ (૩૫ થી ૪૦ વર્ષના આશરાનો) એ બા-બાપુજી ને વિશ્વાસમાં લઈ “તમે કોને ફોન કરો છો જેથી તેમને જણાવેલ કે હું મારા ભાઈ મનુભાઈને ફોન કરુ છું તેથી અજાણ્યા ઇસમે જણાવેલ કે હું તેમને ઓળખુ છું, હું તેમના સમાચાર લેવા આવેલ છું, તેમની પાસે લઈ જાઉ” તેમ કહી સુમીતભાઈની બા ને વિશ્વાસમાં લઈ, તેમની સોનાની બંગડી કિંમત રૂપિયા ૪૦,૦૦૦/- તથા રોકડ રૂપિયા ૫૦૦/- મળી કુલ રૂપિયા ૪૦,૫૦૦/- ની મતા લઈ નાસી જઈ, વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વી.પી.મકવાણા ચલાવે છે.

**ઘરફોડ ચોરી :-**

**સમાચાર યાદી નં.૨૧૯૬/૧૮**

નવરંગપુરા : ડૉ.ઉમાંક બાલેન્દ્ર ત્રીપાઠી (ઉ.વ.૫૧)(રહે.સ્વસ્તીક સોસાયટી, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની બાજુમાં, સ્ટેડીયમ રોડ, સી.જી.રોડ, નવરંગપુરા) એ તા.૯/૧૧/૧૮ નારોજ નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૬/૧૧/૧૮ સવાર ના ૯/૦૦ થી તા.૯/૧૧/૧૮ ના બપોર ના ૦૨/૦૦ સુધીના સમયગાળા દરમ્યાન પોતાના બંધ મકાનના હોલની બારીના સળીયા વાળી નાંખી બારી વાટે અજાણી વ્યક્તિ મકાનમાં પ્રવેશ કરી, મકાનમાંથી સોના-ચાંદીના દાગીના, ડી.વી.ડી.પ્લેયર, સીસીટીવી કેમેરાનું ડી.વી.આર. અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૧,૭૪,૫૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી એચ.બી.પટેલ ચલાવે છે.

અમરાઇવાડી : રૂચિતભાઇ નટવરલાલ પટેલ (રહે.શોપ નંબર-૧૨ જાગૃતિનગર સોસાયટી જોગેશ્વરી સોસાયટી સામે અમરાઇવાડી) એ અમરાઇવાડી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૮/૧૧/૧૮ ના કલાક ૮/૦૦ થી સાંજના ૫/૪૫ વાગ્યા દરમ્યાન પોતાના ઘરમાં અજાણી વ્યક્તિ પ્રવેશ કરી એક સોનાનો દોરો કિંમત રૂપિયા ૨૫,૦૦૦/-, સોનાનું પેડલ કિંમત રૂપિયા ૧૦,૦૦૦/-, ચાંદીની લકી કિંમત રૂપિયા ૧,૦૦૦/-, અને રોકડ રૂપિયા ૩૦,૦૦૦/- તથા એ.ટી.એમ નંગ-૪ મળી કુલ રૂપિયા ૬૬,૦૦૦/- મતાની ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એન.એસ.પરમાર ચલાવે છે.

લુંટ :-

સમાચાર યાદી નં.૨૧૯૭/૧૮

એરપોર્ટ : પ્રિતીબહેન હસમુખલાલ શાહ (ઉ.વ.૪૦)(રહે.લક્ષ્મીકૃપા એપાર્ટમેન્ટ પારસનગર AEC નારણપુરા) એ એ એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૯/૧૧/૧૮ સાંજના ૭/૦૦ વાગ્યાના સુમારે કોતરપુર ટર્નિંગ રોડ ઉપર એકટીવા ઉભુ રાખી, વિમાન જોવા ઉભા હતા દરમ્યાન એક અજાણ્યો પુરૂષ (૨૦ વર્ષના આશરાનો) નજીક આવી એકટીવા ઉપર મુકેલ પર્સ કે જેમા સોના-ચાંદીના દાગીના, મોબાઇલ ફોન તથા રોકડ રૂપિયા ૪,૦૦૦/- મળી કુલ રૂપિયા ૩૭,૫૦૦/- મતાની ભરેલ પર્સ ઝુંટવી લઇ નાસી ગયો હતો. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જે.એસ.ચંપાવત ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૨૧૯૮/૧૮

ઘાટલોડીયા : તેજશભાઇ રસીકલાલ જરગલીયા (ઉ.વ.૩૮)(રહે.સંગીત સરીતા એપાર્ટમેન્ટ આદીનાથનગર મેમનગર)એ પોતાના છુટાછેડા થયેલ હોઇ, ડીપ્રેશનમાં રહેતા હોઇ તા.૦૯/૧૧/૧૮ ના કલાક ૧૨/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે બેડરૂમના પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે ઘાટલોડીયા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી અજીતસિંહ કુલસિંહ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.